



પરીપત્ર

વિષય : New ERP સોફ્ટવેર અંતર્ગત યુ.જી. સેમ.-૨ (NEP-2020) ની પરીક્ષાના, પરીક્ષા ફોર્મની ઓનલાઇન એન્ટ્રી શરૂ કરવા બાબત.

(શૈક્ષણિક વર્ષ : ૨૦૨૩-૨૪ માં એડમિશન લેનાર વિદ્યાર્થીઓ માટે)

આથી ઉપરોક્ત વિષયે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોના આચાર્યશ્રીઓ તથા માન્ય સંસ્થાના વડાઓ તેમજ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને જણાવવાનું કે, New ERP સોફ્ટવેર અંતર્ગત યુ.જી. સેમ.-૨ (NEP-2020) ની પરીક્ષાના, પરીક્ષા ફોર્મની ઓનલાઇન એન્ટ્રીની તારીખ નીચે મુજબ રહેશે. નિયત સમય-મર્યાદામાં કોલેજ દ્વારા તેમના લોગીન મારફત એન્ટ્રી કરવાની રહેશે.

યુ.જી. સેમ.-૨ (NEP-2020) વિદ્યાર્થીઓની Term Grant કરવાની રહેશે જેમાં નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.

College/Department Configuration → Grant Admission → Grant Admission of Students → Click on '+'

ઉપરોક્ત સ્ટેપ્સ પૂર્ણ કરી નીચે મુજબના તબક્કાઓ પૂર્ણ કરવાના રહેશે, નીચે મુજબના તબક્કાઓ જે કોલેજ દ્વારા પૂર્ણ કરવામાં ના આવ્યા હોય તેવી કોલેજોએ વહેલી તકે પૂર્ણ કરી, નીચે મુજબની તારીખોમાં પરીક્ષા ફોર્મની ઓનલાઇન એન્ટ્રી કરવાની રહેશે.

Steps	Menu Name
1. College/Dept. Subject Mapping	College/Department Configuration
2. Student Subject Mapping	Student Configuration
3. Release Students Subject Selection	
4. Add Program Term Division	Master
5. Student Division Mapping	Student Configuration
6. Students Roll No. Generation	

- ઉપરોક્ત ૧ થી ૬ તબક્કાઓ અંગેની માર્ગદર્શિકા તેમજ પરીક્ષા ફોર્મ ભરવા તેમજ ચલણ / પરીક્ષા ફોર્મ ફી જનરેટ તેમજ પ્રિન્ટ કરવા અંગેની માર્ગદર્શિકા અગાઉ અત્રેની યુનિવર્સિટીની વેબસાઇટ પર મુકવામાં આવેલ છે તે મુજબ રહેશે.

[પરીક્ષા ફોર્મ ફી, અત્રેની યુનિ. ના પરીપત્ર ક્રમાંક નં: બીકેએનએમયુ/પરીક્ષા/૧૪૭/૨૦૨૩, તા.૧૭/૦૧/૨૦૨૪ ધ્યાને લેવાનો રહેશે.]

કોર્ષનું નામ	રેગ્યુલર ફી	લેઇટ ફી [રેગ્યુલર ફી + ૫૦૦]	ઠંડાત્મક ફી [રેગ્યુલર ફી + ૫૦૦ + ૧૫૦૦]
યુ.જી. સેમ.-૨ (NEP-2020)	તા.૩૦/૦૪/૨૦૨૪ થી તા.૦૬/૦૫/૨૦૨૪	તા.૦૭/૦૫/૨૦૨૪ થી તા.૦૮/૦૫/૨૦૨૪	તા.૦૮/૦૫/૨૦૨૪

ખાસ નોંધ:

ઉપરોક્ત અભ્યાસક્રમની થીયરી પરીક્ષા શરૂ થવાની સંભવિત તારીખ : ૧૩/૦૬/૨૦૨૪ રહેશે જેની સર્વે સંબંધિતોએ ખાસ નોંધ લેવી.





ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ
(ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ અધિનિયમ નં. ૧૫/૨૦૨૩)
BHAKTA KAVI NARSINH MEHTA UNIVERSITY, JUNAGADH
[Gujarat Public Universities Act No. 15/2023]



છેલ્લી તારીખ બાદ કરવામાં આવેલ સુધારો સોફ્ટવેર સ્વીકારશે નહીં. દંડાત્મક ફી ની તારીખ બાદ પણ જો કોઈ વિદ્યાર્થીનું પરીક્ષા ફોર્મ ઓનલાઇન ભરવાનું બાકી રહેલ હોય તો તેવા વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ અત્રેની યુનિવર્સિટી ખાતેથી **ડબલ દંડાત્મક ફી [દંડાત્મક ફી × ૨(બે)]** ભરી પરીક્ષા ફોર્મ ભરવાનું રહેશે.

રેગ્યુલર ફીની છેલ્લી તારીખ સુધીમાં ચલન જનરેટ કરવાનું રહેશે, તેવી જ રીતે લેઇટ ફી અને દંડાત્મક ફી માટે અલગ-અલગ ચલણ જનરેટ કરવાના રહેશે. જો કોઈ કોલેજ દ્વારા ઉપર મુજબ ચલન જનરેટ કરવામાં નહીં આવે તો ત્યારબાદની તારીખમાં ચલન જનરેટ થશે નહીં જેની ગંભીરતાથી નોંધ લેવી.

છેલ્લી તારીખ બાદ ચાલુ કામકાજના દિવસ ૨(બે)માં ફરજિયાત પણે ચેકલિસ્ટ તેમજ ચલણ, પરીક્ષા વિભાગમાં જમા કરવાનું રહેશે, જો કોલેજ દ્વારા નિયત સમયમર્યાદા બાદ પરીક્ષા ફોર્મ જમા કરવામાં આવશે તો તેવી કોલેજના બેઠક નંબર જનરેટ થશે નહીં જેથી તેની સંપૂર્ણ જવાબદારી જે-તે કોલેજની રહેશે. જેની ગંભીરતાથી નોંધ લેવી. પરીક્ષા ફોર્મ ફી ફરજિયાત પણે ઓનલાઇન માધ્યમ અથવા બેંકમાં ચલણ મારફત ઓફલાઇન માધ્યમ દ્વારા જ ભરવાની રહેશે. અન્ય કોઈ પણ પ્રકારે ફીનો સ્વીકાર કરવામાં આવશે નહીં તેમજ જો ઓનલાઇન માધ્યમ દ્વારા ચુકવણી કરેલ હોય તો તેના આધાર પૂરાવાની નકલ જોડવાની રહેશે અથવા જો બેંકમાં ચલણ મારફત ઓફલાઇન માધ્યમ દ્વારા ચુકવણી કરેલ હોય તો ચલણમાં ફરજિયાત પણે બેંકના સહી સિક્કા કરાવવાના રહેશે. ચલણમાં **Payment Reference Number** તેમજ ચુકવણીની તારીખ દર્શાવવી ફરજિયાત છે. જેની ખાસ નોંધ લેવી.

ખાસ નોંધ :

૧. દરેક વિદ્યાર્થીએ પરીક્ષા ફોર્મમાં જે વિષય દર્શાવેલ હોય તે જ વિષયની કોલેજ દ્વારા સોફ્ટવેરમાં એન્ટ્રી કરવી.
૨. કોલેજ દ્વારા પરીક્ષા ફોર્મની એન્ટ્રી થયા બાદ ફરજિયાત વેરીફાય કરી લેવાનું રહેશે.
૩. પરીક્ષાના આવેદનપત્ર કોલેજ પોતાની પાસે રેકોર્ડમાં સાચવીને રાખવાં, જરૂર પડયે યુનિવર્સિટી દ્વારા મંગાવવામાં આવે તો રજૂ કરવાનાં રહેશે.
૪. પરીક્ષા ફોર્મ ભરનાર તમામ વિદ્યાર્થીઓના ABC ID ની ઓનલાઇન એન્ટ્રી કરવી ફરજિયાત છે. જે વિદ્યાર્થીઓના ABC ID બનાવેલ ના હોય તેવા વિદ્યાર્થીઓના ABC ID બનાવી ત્યારબાદ પરીક્ષા ફોર્મની ઓનલાઇન એન્ટ્રી કરવાની રહેશે.

ડી. ડી. આર. સુમડીયા
પરીક્ષા નિયામક

ક્રમાંક - બીકેએનએમયુ/પરીક્ષા/૫૫૮/૨૦૨૪

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી,

ગવર્નમેન્ટ પોલીટેકનીક કેમ્પસ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી રોડ,

ખડિયા, જૂનાગઢ-૩૬૨૨૬૩

તા.૨૯/૦૪/૨૦૨૪

પ્રતિ, યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોના આચાર્યશ્રીઓ, માન્ય સંસ્થાના વડાઓ તેમજ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો તરફ....

નકલ સવિનય રવાના :-

- | | |
|--|---|
| (૧) માન.કુલપતિશ્રીના અંગત સચિવશ્રી (જાણ અર્થે) | (૨) આઇ.ટી. સેલ (વેબસાઇટ પર પ્રસિધ્ધ થવા તેમજ યોગ્ય કાર્યવાહી અર્થે) |
| (૩) હિસાબી શાખા. (યોગ્ય કાર્યવાહી અર્થે) | (૪) એકેડેમિક વિભાગ (યોગ્ય કાર્યવાહી અર્થે) |

સરકારી પોલીટેકનીક કેમ્પસ,
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી રોડ,
ખડિયા, જૂનાગઢ-૩૬૨ ૨૬૩, ગુજરાત(ભારત)
ફોન નં.૦૨૮૫-૨૬૮૧૪૦૦ / ફેક્સ નં.૦૨૮૫-૨૬૮૧૫૦૩



www.bknmu.edu.in



exam@bknmu.edu.in

Government Polytechnic Campus,
Bhakta Kavi Narsinh Mehta University Road,
Khadiya, Junagadh-362263 (Gujarat)
Ph: 0285-2681400 Fax: 0285-2681503

Help Manual


Subject Selection mapping Module For college

College /Department Subject Mapping

- Logging Your Username and password

<https://bknmuerp.in>

- Select [College / Department Management](#) module



Step : 1

- Go to College Department Configuration then select college/Department Subject Mapping
- Choose subject for which your college has been granted university permission

The screenshot displays the BKNMU web application interface. The top navigation bar shows the BKNMU logo, a menu icon, and the text 'Academic Year: 2022-2023' and 'Welcome, CL010230'. The left sidebar menu includes options like Home, Dashboard, Masters, College / Department Configuration, Student Transfer, Student Configuration, Internal / Practical Exam, Grant Admission, Attendance, Certificate, Departmental Events/Activities, and Reports. The main content area is titled 'View College / Department Subject Mapping Details'. A red arrow points to a blue '+' button with the text 'PLEASE CLICK + Add NEW COLLEGE DEPTMENT SUBJECT MAPPING'. Below this are form fields for 'Admission Year' (set to 2022-2023), 'College / Department Subject Mapping' (set to S.E.T. MAHILA ARTS, COMM, B.B.A., HOME SCI. COLLEGE), 'Program Name' (-Please Select-), and 'Academic Batch Name' (-Please Select-). There is a search bar and a table with columns: Sr. No., Admission Year, College / Department Name, Program Name, Academic Batch Name, Term, No. of Subjects, Edit, and Delete. The table is empty, showing 'No data available in table'. The bottom of the page shows the Windows taskbar with the search bar and system tray.

- Click “ + “ Symbol Add New College/Department Subject Mapping

The screenshot shows a web application interface for adding a new college/department subject mapping. The interface includes a sidebar with navigation options like Home, Dashboard, Masters, College / Department Configuration, Student Transfer, Student Configuration, Internal / Practical Exam, Grant Admission, Attendance, Certificate, Departmental Events/Activities, and Reports. The main content area shows a form with fields for Admission Year (2022-2023), College / Department (S.E.T. MAHILA ARTS, COMM., B.B.A., HOME SCI. COLLEGE), Program Name (BACHELOR OF ARTS), Academic Batch Name (B.A. 2022-23), and Term (B.A. Semester - 1). Below the form is a 'Subject Details' section with a table of subjects. The first subject, 'BA0SFC1010 - SANSKRIT: P1.BRTUHARI: NITISHATAK', is selected with a checked checkbox. A red arrow points to this checkbox, and a red text annotation says 'Select Checkbox'. Other subjects listed include 'FOUNDATION CLASSICAL LANGUAGE', 'FOUNDATION HINDI', and 'CORE' subjects like 'ECONOMICS' and 'ENGLISH'.

- Select Program Name, Academic Batch Name and Term. Then Select Check box for your college/Department Subject mapping
- Also View College/Department Subject Mapping

Step : 2

I. Student Subject mapping

- Student Configuration
- Go to Student Configuration select Student Subject mapping

Academic Year: 2022-2023 Welcome, testadmin

View Student Subject Mapping Details

+ Add New Student Subject mapping

Admission Year: * 2022-2023 College / Department Name: * -Please Select-

Program Name: * -Please Select- Academic Batch Name: * -Please Select-

Show 10 entries per page Search:

Sr. No.	Academic Year	College / Department Name	Program Name	Academic Batch Name	Enrollment Term	Student Name	Is MBP Subject Selection?	View	Edit	Delete
No data available in table										

Showing 0 to 0 of 0 entries Previous Next

Type here to search 30°C Smoke ENG 3:34 PM IN 08-Dec-22

- Click “ + “ Symbol Add New Student Subject Mapping .

- Select Program Name, Academic Batch Name and Term Syllabus batch Name. Then Select Check box for your Student Subject mapping and also Select Student for this Subject. check all Details after you Submit.
- To delete All student subject selected for click cancel option. Only one student deleted for × click Symbol
- Also View Student Subject Mapping.

II. Release Student Subject Selection

Admission Year: * 2022-2023

College / Department: * COLLEGE OF COMPUTER, SCIENCE & INFORMATION TECHNOLOGY

Program Name: * BACHELOR OF SCIENCE AND INFORMATION TECHNOLOGY

Academic Batch Name: * BSC(IT) 2022-23

Syllabus Batch Name: * BSC(IT) 2022-23

Term: * B.Sc.(IT) Semester - 1

Unfreeze

View Students: *

Subject Selection Release Pending

Subject Selection Released

Subject Selection Pending

UnRelease Subject Selection (Withdrawal Cases)

Specialization: -Please Select-

Student Details

Sr. No.	<input type="checkbox"/>	Enrollment No.	Student Name	Subject Count	View
1	<input type="checkbox"/>	E22013108001010001	ARDESHNA ANUSHKA YATINBHAI	6	
2	<input type="checkbox"/>	E22013108001010002	BARVADIYA VARTIKA PARSOTAMBHAI	6	
3	<input type="checkbox"/>	E22013108001010003	BHATT LENCYBEN YOGESHBHAI	6	

- Select Program Name, Academic Batch Name and Term, Syllabus batch Name Freeze Data.
- Then show view student option Select any one option
 - A. Subject Selection Release Pending,
 - B. Subject Selection Released,
 - C. Subject Selection Pending,
 - D. Unrelease Subject Selection (Withdrawal Cases)

- Show Student Details check All Details and select Check box then Submit to this page.

III. Student Division Mapping

- Go to master and selete program Term Division mapping

The screenshot shows the BKNMU Department Dashboard. The top navigation bar includes the BKNMU logo, a menu icon, the text 'Academic Year : 2022-2023', and 'Welcome, testadmin'. The left sidebar contains navigation options: Home, Dashboard, Masters, College / Department Configuration, and Student Configuration. The main dashboard area has a 'Department' header and a 'Dashboard' section with the following filters and summary cards:

- Admission Year:** 2022-2023
- College:** A.R. BHATT P.G. CENTER FOR MSW
- Program:** MASTER OF SOCIAL WORK
- Batch:** MSW 2022-23
- Semester:** M.S.W Semester -1

Summary Cards:

- NO. OF PROGRAM:** 1 (College Wise)
- NO. OF STUDENT:** 44 (College Wise)
- NO. OF TEACHER:** 12 (College Wise), 0 (College Wise Visiting Teacher)

Program Wise Student: A chart showing a single blue oval representing 1 program.

Semester Category And Gender Wise Student:

	EWS	General	SC	SEBC	ST
Female	7	24	42	37	0
Male	0	39	55	14	0

Semester Result Category And Gender Wise Student: A chart showing 0 results.

Goal Completion Student: A chart showing 0/218 results.

At the bottom, there is a navigation bar with the URL: <https://department.bknmuerp.in/CollegeMasters/ViewProgramTermDivisionMapping.aspx> and a Windows taskbar with system tray information (30°C, Smoke, 1:30 PM, 08-Dec-22).

- Go to College Department > Master and Click Program Term Division
- New Add program Term Division

The screenshot displays the 'Add Program Term Division Mapping' interface. The top navigation bar shows the BKNMU logo and the user's name 'Welcome, CL010230'. The left sidebar lists navigation options: Home, Dashboard, Masters, College / Department Configuration, and Student Configuration. The main form area contains the following fields:

- Admission Year: 2022-2023
- College / Department: S.E.T. MAHILA ARTS, COMM., B.B.A., HOME SCI. COLLEGE
- Program Name: BACHELOR OF ARTS
- Academic Batch Name: B.A. 2022-23
- Term: B.A. Semester - 1


The 'Division Details' section includes an 'Add Division' button and a table with the following structure:

Sr. No.	Medium	College Program Type	Division Name	Is Active	Remove
1	None selected -	None selected -	<input type="text"/>	<input checked="" type="checkbox"/>	<input type="button" value="x"/>

At the bottom of the form are 'Submit' and 'Cancel' buttons. The Windows taskbar at the bottom shows the system tray with the date '13-Dec-22' and time '3:51 PM'.

- Click “+” Symbol then Add a new program Term Division Mapping.
- No, of Division. example No of Division: -1 open one column and also add one or more Division click add Divi.
- Also View program Term Division Mapping.

- Go to College Department Select Student Division Mapping.



- Click “ + “ Symbol Add New Student Division Mapping.
- Also View Student Subject Mapping.

College / Department Configuration

Student Configuration

College / Department: * BAHAUDDIN SCIENCE COLLEGE

Program Name: * BACHELOR OF SCIENCE

Academic Batch Name: * B.SC. 2022-23

Term: * SEMESTER-1

Unfreeze

Division: * BSC.A

Filter Criteria

Filter By: * -Please Select-

From: To: Generate

Student Details

Sr. No.	Enrollment No.	Surname	Name	Father's Name
---------	----------------	---------	------	---------------

select submit

Submit Cancel

select Division

Select student

- Select Program Name, Academic Batch Name and Term, Syllabus batch Name Freeze Data.
- After Select Division, Select Filter option Garnet and select checkbox for Student Details Submit to page.

IV. Student Roll Number

- Go to College Department Select Student Roll Number.

The screenshot displays a web application interface for adding student roll numbers. The interface includes a sidebar with navigation options like Home, Dashboard, Masters, College/Department Configuration, and Student Configuration. The main content area contains several dropdown menus for Admission Year (2022-2023), College/Department (S.E.T. MAHILA ARTS, COMM., B.B.A., HOME SCI. COLLEGE), Program Name (BACHELOR OF ARTS), Academic Batch Name (B.A. 2022-23), and Term (B.A. Semester - 1). There is an 'UnFreeze' button and a 'Division' dropdown set to '-Please Select'. A checkbox 'Generate Roll Nos Automatically?' is checked. Below this is a 'Roll No Configuration' section with 'Prefix' and 'Start No.' input fields. The 'Student Details' section has 'Sorting Type' set to 'Ascending' and 'Sorting Preferences' set to 'Name - Father's Name - Surname - Enrollment No', with a 'Generate' button. At the bottom, there are 'Submit' and 'Cancel' buttons. The browser's address bar shows the URL 'https://department.bknmuerp.in/CollegeMasters/AddStudentRollNumber.aspx'.

- Select Program Name, Academic Batch Name and Term, Syllabus batch Name and Freeze Data.
- Select Division. Generate Roll Nos Automatically Click Checkbox. And generate roll no. all student detail show and seat no.

Help Manual

Pre-Examination Module For College

Guj Info Petro Limited

Confidential

This information is confidential and proprietary to GIPL and is to be used only for the purpose for which it is provided. Reproduction by any means, electronic or mechanical, and distribution to third parties without express written permission of GIPL is not permitted.

Table of Contents

1. Generate Provisional Exam Form.....	3
2. Examination Form and College Verification.....	5
3. Activity Wise Payment (Exam Activity)	6
4. Payment Transaction Search.....	7

1. Generate Provisional Exam Form

Insert Functionality:

- The page shall allow the Colleges to generate provisional exam forms in bulk.

Generate Provisional Exam Form

Home > Generate Provisional Exam Form

College * COLLEGE OF COMPUTER, SCIENCE & INFORMATION TECHNOLOGY

Program * BACHELOR OF SCIENCE AND INFORMATION TECHNOLOGY

Program Term * B.Sc.(IT) Semester - 1

Exam * BACHELOR OF SCIENCE AND INFORMATION TECHNOLOGY B.SC.(IT) SEME...

Exam Type * Regular

[Un-Freeze](#)

Student Details:

Show entries Search:

<input type="checkbox"/>	Sr No.	SP ID	Enrolment No	Name	Father Name	Surname	Academic Batch	Enrolment Year	Specialization / Major Type Name
<input type="checkbox"/>	1	20221012805	E22013108001010007	KRISHA	DILIPKUMAR	DHULESHIYA	BSC(IT) 2022-23	2022-2023	

Showing 1 to 1 of 1 entries [Previous](#) [1](#) [Next](#)

Note : On click of Generate, Provisional Exam Forms would be generated with Latest available Subject Selection from College/Department.
Student should approach their College/Department and make necessary changes of their Subject Selection before Submitting Final Exam Forms for Verification.

[Submit](#)

Activate Windows
Go to Settings to activate Windows.

View Functionality:

- User can View all records.
- Users can also Export/ Delete Multiple records.

Generate Provisional Exam Form

Show 10 entries Search:

<input type="checkbox"/>	Sr No.	College Name	Program Name	Term Name	Exam Name	Regular	Part	Exam Form Generation
<input type="checkbox"/>	Se:	Search	Search	Search	Search	Search	Se:	Search
<input type="checkbox"/>	1	COLLEGE OF COMPUTER, SCIENCE & INFORMATION TECHNOLOGY	BACHELOR OF SCIENCE AND INFORMATION TECHNOLOGY	1	BACHELOR OF SCIENCE AND INFORMATION TECHNOLOGY B.SC.(IT) SEMESTER - 1 DECEMBER-2022	Yes	No	1
<input type="checkbox"/>	2	COLLEGE OF COMPUTER, SCIENCE & INFORMATION TECHNOLOGY	BACHELOR OF SCIENCE AND INFORMATION TECHNOLOGY	1	BACHELOR OF SCIENCE AND INFORMATION TECHNOLOGY B.SC.(IT) SEMESTER - 1 DECEMBER-2022	Yes	No	1
<input type="checkbox"/>	3	COLLEGE OF COMPUTER, SCIENCE & INFORMATION TECHNOLOGY	BACHELOR OF SCIENCE AND INFORMATION TECHNOLOGY	1	BACHELOR OF SCIENCE AND INFORMATION TECHNOLOGY B.SC.(IT) SEMESTER - 1 DECEMBER-2022	Yes	No	1
<input type="checkbox"/>	4	COLLEGE OF COMPUTER, SCIENCE & INFORMATION TECHNOLOGY	BACHELOR OF SCIENCE AND INFORMATION TECHNOLOGY	1	BACHELOR OF SCIENCE AND INFORMATION TECHNOLOGY B.SC.(IT) SEMESTER - 1 DECEMBER-2022	Yes	No	1

Showing 1 to 4 of 4 entries

2. Examination Form and College Verification

Insert Functionality:

- College User can verify Exam form of students **one by one.**
- College user also selects Answering Language, Payment Information and also change Subject selection if required of selected students.

The screenshot displays the 'Examination Form & College Verification' web application. On the left is a dark sidebar with navigation options: HOME, DASHBOARD, MASTER, FEE, ENROLMENT / PG REGISTRATION, REPORT, and PRE-EXAMINATION. The main content area is titled 'Examination Form & College Verification' and contains the following fields and controls:

- College:** COLLEGE OF COMPUTER, SCIENCE & INFORMATION TECHNOLOGY
- Program:** BACHELOR OF SCIENCE AND INFORMATION TECHNOLOGY
- Program Term:** B.Sc.(IT) Semester - 1
- Exam:** BACHELOR OF SCIENCE AND INFORMATION TECHNOLOGY B.SC.(IT) SEME...
- Enrolment No:** E22013108001010007 - KRISHA DILIPKUMAR... (with a 'Find' button)
- Un-Freeze** button
- Student Details:**
 - Student Name:** KRISHA DILIPKUMAR DHULESHIYA
 - Date of Birth:** 04/02/2004
 - SP ID:** 20221012805
 - Exam Type:** Regular Part
 - Answering Language:** --Please Select--
 - Is Payment Done by Student at College / Department ?**
 - Payment Mode:** -- Please Select --
 - Student Payment Reference No:** [Text Input]
 - Student Payment Date:** DD/MM/YYYY
 - Student Payment Remarks:** [Text Input]
 - Fee Amount:** 100.0000
 - Syllabus Academic Batch:** BSC(IT) 2022-23
- Subject Details:**
 - Show 10 entries
 - Table with columns: Sr No., Subject Group Name, Subject Name

The Windows taskbar at the bottom shows the system tray with temperature (30°C), time (14:49), and date (14-12-2022).

3. Activity Wise Payment (Exam Activity)

Functionality:

- College User can generate challan for bulk of Examination forms.
- Upon generation of challan a unique challan number will be generated which will be used in payments.
- List of applicants will be shown after selected parameter search with having check box selection facility by which bulk payment process will be done.
- Cash and Cheque/ Draft payment options are available for payment.
- If user selects cash challan option, then cash challan will be printed for colleges.
- If user selects Cheque/ Draft option then related Cheque/ Draft No, Date and Bank Name are entered then challan will be printed for colleges.

Applicant List For Payment (Exam Activity Wise)

Home > Applicant List For Payment (Exam Activity Wise)

Activity * Examination Form

College * COLLEGE OF COMPUTER, SCIENCE & INFORMATION TECHNOLOGY

Faculty * FACULTY OF SCIENCE

Program * BACHELOR OF SCIENCE AND INFORMATION TECHNOLOGY

Program Term * B.Sc.(IT) Semester - 1

Exam * BACHELOR OF SCIENCE AND INFORMATION TECHNOLOGY B.SC.(IT) SEME...

Exam Type Regular

[View](#)

ExamForm Student List:

Show 10 entries Search:

<input checked="" type="checkbox"/>	Enrolment No	Student Name	Student Batch	Exam Type	Payment Done By Student At College
<input checked="" type="checkbox"/>	E22013108001010001	ARDESHNA ANUSHKA YATINBHAI	BSC(IT) 2022-23	REGULAR	Yes
<input checked="" type="checkbox"/>	E22013108001010002	BARVADIYA VARTIKA PARSOTAMBHAI	BSC(IT) 2022-23	REGULAR	Yes
<input checked="" type="checkbox"/>	E22013108001010004	BHEDA RAJAN PARBATBHAI	BSC(IT) 2022-23	REGULAR	Yes
<input checked="" type="checkbox"/>	E22013108001010005	BHETARIYA UMANG ASHOKBHAI	BSC(IT) 2022-23	REGULAR	Yes

Windows watermark: Activate Windows. Go to Settings to activate Windows.

4. Payment Transaction Search

Functionality:

- Using this page, university/ college user can update payment status of offline / online payments with Re-initiate payment.
- Payment list will be populated as per selection of fields.
- In form's list we can see the "No of Students, Payment Information's, Re-initiate Payment"
- In form's list we can delete payment of those whose status is pending.
- User can also export payment list in excel from EXPORT ALL button.
- User can also view students list from "Number of students" field.

Payment Transaction Search

Activity * Examination Form

College Name * COLLEGE OF COMPUTER, SCIENCE & INFORMATION TECHNOLOGY

Faculty Name * FACULTY OF SCIENCE

Program Name * BACHELOR OF SCIENCE AND INFORMATION TECHNOLOGY

Term * B.Sc.(IT) Semester - 1

Exam * BACHELOR OF SCIENCE AND INFORMATION TECHNOLOGY B.SC.(IT) SEM...

Exam Type Regular

Payment Status -- Please Select --

Search Recon Export All Duplicate Payment Data

Payment List:

Show 10 entries Search:

Sr No.	Payment No	Payment Activity	No Of Students	Amount	Payment Mode	Payment Status	Payment Approved	Approved Date Time	Payment Info	Receipt	Re-initiate Payment	Delet
1	EF22121200003	Exam Fees for 2022-2023 Exam - BACHELOR OF SCIENCE AND INFORMATION TECHNOLOGY B.SC.(IT) SEMESTER - 1	1	100.00	Cash Challan	Pending	PENDING					Delet

Activate Windows
Go to Settings to activate Windows.